https://archive.org/details/bk744/page/n0/mode/1up

1979-03 -Jagruti (744)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન
સમાજ યુવક મંડળ તરફથી

સેવા, સંગઠન અને સહકારનો ઉચ્ચ
આદર્શ રજુ કરતું પ્રાણવાન
માસિક

જાગૃતિ

શ્રી ઉમીયાય નમઃ

તંત્રી : કાન્તિભાઇ કે. પટેલ બી. એ.

વર્ષ : ૨૧ અંક : ૩ માર્ચ ૧૯૭૯

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk744/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 3.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk744/page/n2/mode/1up

1979-03 -Jagruti (744)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.19 15:19:03 +05'30'

realpatidar.com

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન
સમાજ યુવક મંડળ તરફથી

સેવા, સંગઠન અને સહકારનો ઉચ્ચ
આદર્શ રજુ કરતું પ્રાણવાન
માસિક

જાગૃતિ

શ્રી ઉમીયાય નમઃ

તંત્રી : કાન્તિભાઇ કે. પટેલ બી. એ.

વર્ષ : ૨૧ અંક : ૩ માર્ચ ૧૯૭૯

realpatidar.com

https://archive.org/details/bk744/page/n3/mode/1up

realpatidar.com

આદ્ય સુધારક અને પાટીદાર સમાજને જાગૃત કરનાર

પટેલ નારાયણભાઈ રામજીભાઈ લીંબાણી

[વીરાણી–કચ્છ]

જન્મ :	સ્વર્ગવાસ :
સંવત ૧૯૩૯ વૈશાખ પૂર્ણિમા	સંવત ૧૯૯૭ આસો વદ ચૌદસ

realpatidar.com

realpatidar.com

અનુક્રમણિકા

અ.નં.	લેખ	લેખક કે સંપાદક	પૃષ્ઠ
૧	તંત્રીસ્થાનેથી	કાન્તિલાલ કે. પટેલ	૧
૨	દંભ	શામજીભાઇ એસ. પટેલ	૩
૩	સર્વ વ્યાપક પ્રભુને શોધવાની વ્યવસ્થિત યોજના એટલે મૂર્તિપૂજા	જયંતિલાલ એન. પટેલ	૫
૪	પૂ. દાદાનાં પ્રવચનોમાંથી	—	૯
૫	ધન્ય ચેલૈયો	અંબાલાલ જી. પટેલ	૧૨
૬	લવાદપંચનો ચુકાદો	—	૧૫
૭	આપણે શું આ ન કરી શકીએ ?	નવચેતન યુવક મંડળ	૨૦
૮	મારું ક્રિકેટ જીવન	અર્ચના વી. પટેલ	૨૨
૯	સમાચાર દર્શન	—	૨૩

realpatidar.com

https://archive.org/details/bk744/page/n5/mode/1up

realpatidar.com

તંત્રીસ્થાનેથી

આદર્શ વેપારી

કૌટુંબિક જીવનની શાંતિનો કેટલોક ભાગ આર્થિક સ્થિતિ પર રહેલો છે. તેથી જ આપણા શાસ્ત્રકારોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા પુરૂષાર્થના ચાર ભાગ પાડયા છે. એનો અર્થ એમ થાય છે કે અર્થ કમાવવા માટે દરેક માણસે પ્રયત્ન કરવો જ જોઇએ. અર્થ કમાવવા માટે દરેક વર્ણના લોકોએ નક્કી કરેલી રીતે મહેનત કરવી જોઇએ જે જુદા જુદા ઘરોમાં જાય છે અને પોતાનો માલ વહેંચે છે, તેને આપણે વેપારી કહીએ છીએ. આજના કાળમાં વેપારીની પાસે પણ લોકો માલ લેવા માટે જાય છે. આમ વેપારીનો આમ જનતા સાથે સીધો સબંધ રહેલો છે.

આપણે આદર્શ વેપારી તેને કહીએ છીએ જે માત્ર પોતાનો માલ જ વેચતો નથી પણ જે ઘેર ઘેર ફરીને ગામડે ગામડે જઇને વૈદિક વિચારો પણ કહે તો રહે છે. આમ આદર્શ વેપારી માટે ભોગ અને યોગ બન્નેની સમતુલા જાળવવી જરૂરી છે. આદર્શ વેપારી જીવન અને જીવિકા બન્નેનો વિચાર કરતો હોવો જોઇએ. તેનો સંબંધ સીધો લોકો સાથે છે. તેથી વેપારી સવારના ભાગમાં ઇશ્વર પૂજા કરે છે. ઇશ્વરને કૃતજ્ઞભાવે યાદ કરે છે. અને ત્યાર પછીના ભાગમાં જે ઇશ્વર તેણે મૂર્તિમાં જોયો હોય છે. તે જ ઇશ્વરને હવે વિસ્તૃત રૂપે જોવા પ્રયત્ન કરે છે. તેથી જ લોકોમાં ભગવાન રહ્યો છે તેમ સમજીને વેપારી પોતાનો વેપાર કરતો હોવો જોઇએ.

વેપારીના મનમાં જીવન વ્યાપી વિચાર મુખ્ય ભાગ ભજવે છે. જીવિકા તેને માટે ગૌણ વાત છે તેથીજ વેપારી અર્થ પ્રધાન કરતાં ધર્મ પ્રધાન વધારે હોવો જોઇએ જે વેપારી માત્ર પોતાના જ શરીરમાંથી નિર્માણ થયેલા કુટુંબીજનોનો જ માત્ર વિચાર કરે છે. તેને આપણે વેપારી કહેવા તૈયાર નથી જેનામાં નર્યો સ્વાર્થ છે. જેનામાં માત્ર ભોગ જીવનની લાલસા છે. જેનામાં માત્ર લૂંટી લેવાની વૃત્તિ જ કામ કરતી રહી છે. તેને આપણે આદર્શ વેપારી કહી ન શકીએ પણ તેને વેપારી પણ ન કહી શકીએ. આદર્શ વેપારી અને (સામાન્ય) વેપારીમાં પણ થોડો તફાવત છે વેપારી, સ્વાર્થ અને પરમાર્થ એ બન્નેની વચ્ચે જો ઘર્ષણ આવશે તો સ્વાર્થને પહેલું પસંદ કરશે. જ્યારે આદર્શ વેપારી તે બંને વચ્ચે ઘર્ષણમાં સ્વાર્થ કરતાં પરમાર્થને વધારે પસંદ કરશે. આદર્શ વેપારી સંતોષી રહે છે. જ્યારે વેપારી લોભી હોય છે. આદર્શ વેપારીમાં બીજાનો વિચાર કરવાની

realpatidar.com

https://archive.org/details/bk744/page/n6/mode/1up

realpatidar.com

પણ કંઇક ને કંઇક આપવા
વૃત્તિ રહેલી હોય છે. સામાન્ય રીતે તે સમાજને પણ કંઇક ને કંઇક આપવા
પ્રયત્ન કરતો હોવો જોઇએ. આદર્શ વેપારી તે છે કે જે ગામમાં તપાસ રાખે છે.
કે આજે કોઇ ભૂખ્યું સુતું નથી ને ? ગામની કોઇપણ વ્યકિત અગવડમાં હશે તો
તેની પહેલી ચિંતા આદર્શ વેપારીને થાય છે. તેથી જ આદર્શ વેપારી અમાસની
રાત જેવો કવિ છે. જે પોતાનો વૈભવ સમાજને ખુલ્લામાં ખુલ્લું દેખાડે છે.
જેથી તેને ત્યાં આવનાર ખાલી હાથ પાછો જતો નથી એટલું જ નહિ કંઇ
કંઈક માગે ત્યારે પછી આવનાર સામાન્ય વેપારી છે જ્યારે સામેવાળાની અગવડ
જાણી લઇને તેને ઘેર પહોંચતું કરનાર આદર્શ વેપારી કહેવાય.

આપણે આગળ કહ્યું તેમ વપારી ભૌતિક વિચારો ધરાવતો હોય, ત્યારે આદર્શ
વેપારી આર્થિક વિચારો ધરાવતો હોય છે. ગુરૂનાનક ઘઉંનો વેપાર કરતા હતા
અને માલ વેચતા વેચતા તેમણે તત્વજ્ઞાન લાધ્યું હતું. તેમ કહેવાય છે જેના
મનમાં સતત ચિંતન-મનન ચાલતું રહયું છે. તેવાને કોઈપણ વ્યવસાય કરતો હોય
છતાં તત્વજ્ઞાન સાથે રહે છે. તે આ વાત પરથી પુરવાર થાય છે. વેપારી સામાન્ય
રીતે જડ પૈસાના સંપર્કમાં રહેતો હોવાથી તેનું મન જડ થઇ જવાની શકયતા
વધારે છે, તેથી જ આદર્શ વેપારી પોતાના મનને ભાવ પ્રધાન બનાવવા માટે હંમેશા
પ્રયત્નશીલ હોય છે. તે માટે તે મહાપુરુષોના સંગમાં રહેવા પ્રયત્ન કરે છે. ભગવાને
મનેજ વૈભવ કેમ આપ્યો તેનો સતત વિચાર કરનાર વેપારી ભગવાનનાં કારુણ્યને
યાદ કરતો રહે છે, અને એમ કરતાં કરતાં ભાવ વિભોર થઈ જાય છે.

આદર્શ વેપારી ભગવાનની કૃપાને માત્ર યાદ કરે છે: એટલું જ નહિ, પણ
પોતાની જે આવક છે, તેમાંનો મોટો ભાગ ભગવદ્ કાર્યમાં વાપરે છે. સૃષ્ટિમાં
ભગવાન સૌને સુખી કરવા પ્રયત્ન કરે છે, તેવી જ રીતે વેપારી પણ જે વિચારથી
લોકો સુખી થાય, તેવા વિચારનાં પ્રચાર માટે પોતાની આવક વાપરવા લાગશે, આમ
આદર્શ વેપારી ઉદાર હોય છે. એટલું જ નહિ પણ ભગવાનનો ભાગ કાઢીને સાચા
અર્થમાં ભગવાનની સેવા કરવા પ્રયત્ન કરે છે. તે પોતેજ પોતાના પૈસામાંથી એવી
રીતે દાન કરે છે. કે તે દાન લેનારને હલકો પડવા દેતો નથી. દાન લેનાર મોટો
છે, એમ સમજી ને તે દાન આપે છે જે કોઈપણ વૈદિક વિચારો માટે, વૈદિક
વિચારોને ઊભા કરવા માટેનો પ્રયત્ન કરતું હશે, તેવાને એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રીયને
તપસ્વીને, સદ્‌ગુણીને, આ વેપારી એવી રીતે સહાય કરશે કે-જેથી સામાવાળાનું
મન ખીલવા લાગશે. આમ, આદર્શ વેપારી વેદ માટે ભગવાન માટે સમાજ માટે
કુટુંબીજનો માટે અને પોતાને માટે યોગ્ય એવું વર્તન કરતો હોવો જોઇએ.

realpatidar.com

https://archive.org/details/bk744/page/n7/mode/1up

realpatidar.com

"દંભ"

શામજીભાઈ એસ. પટેલ
વડોદરા.

માણસ બાળક મટીને મોટો થતો જાય છે તેમ તેમ તેનામાં ઘણી બાબતોનો વિકાસ થતો જાય છે. તેમાં સારી બાબતો સાથે કેટલીક ખરાબ બાબતોનો પણ વિકાસ થાય છે. ઈર્ષા, વેરભાવ, ડંખ, વગેરે ઘણું ઘણું તેના મનમાં સંઘરાયેલું રહે છે, અને તે મનના અંધકારમાં ફુલતું ફાલતું રહે છે. તેની સાથે કેટલીક સારી બાબતોનો પણ વિકાસ થાય છે પરંતુ એક વસ્તુ એવી છે કે માણસમાં રહેલી સારી બાબતોને તે ઢાંકી દે છે, અને તે છે "દંભ".

માણસ પોતાની આસપાસ જે અનુકરણીય વ્યક્તિઓને જુએ છે તેના જેવા બનવાનો પ્રયત્ન કરે છે, પણ તેમ કરવામાં તેનામાં રહેલા પ્રાકૃતિક ગુણના કારણે લગભગ માણસો નિષ્ફળ જાય છે, અને એવી નિષ્ફળતા મોટાભાગે માણસને દંભી બનાવે છે.

દંભી વ્યક્તિ પોતે જેવી નથી તેવી દેખાવા પ્રયત્ન કરે છે. પોતે હોય તેના કરતાં વધારે ધનવાન, બુદ્ધિમાન કે બહાદુર દેખાવાનો પ્રયત્ન કરે છે. ઓછે વત્તે અંશે આ બિમારી દરેક માણસને વળગેલી હોય છે. પ્રશંસા કે કીર્તિની એષના તેના મનમાં એટલી ઊંડી હોય છે કે તે ત્યજી શકાતી નથી. હકીકતમાં દંભી માણસની પ્રશંસા કરનારાઓ પણ દંભી જ હોય છે. આમ દંભની પ્રક્રિયા વધતી જ હોય છે.

દંભી વ્યક્તિ એમ માને છે કે બીજા લોકોની તે સફળતા પૂર્વક બનાવટ કરે છે પરંતુ ખરી રીતે તે માત્ર પોતાની જાતની જ બનાવટ કરે છે, કારણ કે જે વ્યક્તિનો આનંદ બીજા કોઈ તેની પ્રશંસા કરે તેના પર નિર્ભર હોય તે વ્યક્તિ ખરેખર કમનસીબ ગણાય. તેને સદાય પરવશ અને ઓશિયાળી સ્થિતિમાં જીવવુ પડે છે છતાં તે માન્યા કરે છે કે તે બીજા બધાથી શ્રેષ્ઠ છે. તેને પોતાની નગ્નતા ઢાંકવા ઘણા ઘણા પ્રયત્નો કરવા પડે છે.

આધુનિક સમાજમાં રાજકીય પુરૂષોમાં અને રાજકારણમાં આ રોગ ઘણા વ્યાપક પ્રમાણમાં પ્રસરેલ છે. રાજકીય પુરૂષો તેમની જીંદગીમાં ડહાપણના ભંડાર હોંશિયાર, બહાદુર, નિડર, બુદ્ધિશાળી અને સર્વ ગુણોના ભંડાર રૂપ ગણાતા હોય

realpatidar.com

https://archive.org/details/bk744/page/n8/mode/1up

realpatidar.com

છે, પરંતુ તે પોતાના સ્થાન પરથી ફેંકાઇ જતાં જ તે મૂર્ખ, ડરપોક, વામણા અને બિનલાયકાત વ્યક્તિ તરીકે ખુલ્લા પડી જાય છે. દંભ તો જીવનના દરેક ક્ષેત્રોમાં હોય છે પરંતુ જેમાંથી માણસને પ્રશંસા અને પૈસા મળે છે તેવા ક્ષેત્રોમાં તે વધારે પ્રમાણમાં વ્યાપેલો હોય છે.

ધર્મ ક્ષેત્રે પણ દંભ : ધર્મનું ક્ષેત્ર તો રાજકારણ કરતાં પણ નધણીયાતું છે ધર્મના નામે કોઇ લુચ્ચો દંભી માણસ આ જગતમાં ગમે તે કરી શકે છે. માણસ જાત સ્વભાવે જ શ્રધ્ધાળુ હોય છે શ્રધ્ધા અને આશા તો તેને વારસામાં મળ્યાં છે. તેનો ગેરલાભ ઉઠાવવાનું કામ હમેશા શઠ માણસોએ કર્યું છે અને એવા શઠ માણસોને શ્રધ્ધાનું ક્ષેત્ર સૌથી વધુ ફળદાયી લાગ્યું છે.

કોઇ એક ધર્મ ધુરંધર લોકોની નજર સામે ગમે તેવા ખોટાં કામો કરી કે ચમત્કારો બતાવીને મૂર્ખ બનાવી શકે છે પોતે મૂર્ખ હોવા છતાં બુધ્ધિશાળીઓને પોતાના ચરણોમાં નમાવી શકે છે. પોતે કંઇ નથી જાણતા હોવા છતાં ત્રિકાળજ્ઞાની હોવાનો ડોળ કરે છે. પોતે બિમાર હોવા છતાં બીજાના દર્દ દૂર કરવાનો દાવો કરે છે છતાં કયારેય પણ તેને કશો પડકાર કરી શકાતો નથી. ડાહ્યા દેખાતા માણસો ધર્મની વાત આવતાં ગમે તેવી ગાંડીઘેલી વાતો કરવા લાગે છે. નાનકડી વાતમાં પણ તર્ક અને દલીલો કરનાર બુદ્ધિજીવીઓ ધર્મના નામે ગમે તે વસ્તુ સ્વીકારવા તૈયાર થઇ જાય છે. ધર્મમાં બુધ્ધિ અને તર્કને સ્થાન નથી હોતુ. આમ કમનસીબી એ છે કે એ બધી ચહલ પહલમાં સાચો ધર્મ તો કયાંય છૂપાઇ જાય છે. ધર્મના નામે ધતિંગ અને દંભજ ચાલુ રહે છે. ચારે તરફ તેનીજ બોલબોલ થાય છે.

દંભી માણસની સખ્યા ધર્મ અને રાજકારણના ક્ષેત્રમાં જેટલી જોવા મળે છે તેટલી કદાચ બીજે જોવા મળતી નથી કારણ કે દંભીને ટકી રહેવા તથા છૂપાવા માટે જે ઝાકઝમાળ અને આભાની જરૂર હોય છે તે આ બે સ્થાનમાંથી સ્વાભાવિક રીતે મળી રહે છે.

પરંતુ ત્યાં એકજ વસ્તુ હોતી નથી "સુખ અથવા શાંતિ" આ વસ્તુ મેળવવા માટે તો તેને દંભનો ત્યાગ કરવો પડે છે. દંભ કરનાર માણસની મોટા ભાગની શકિતઓ તે દંભને ઢાંકવા કે ટકાવી રાખવા પાછળ જ ખર્ચાતી હોય છે તથી તેને નિરાંત કયારેય મળતી નથી.

realpatidar.com

https://archive.org/details/bk744/page/n9/mode/1up

realpatidar.com

સર્વવ્યાપક પ્રભુને શોધવાની વ્યવસ્થિત યોજના એટલે "મૂર્તિપૂજા"

જયંતિલાલ નારણ પટેલ
શિવનગરકંપા
જિ. ગાંધીનગર

ભગવાન સર્વત્ર છે. પણ તે જડતો નથી. એક ભાઇ જંગલમાં ગયા ત્યાં બધે લીલુંછમ જોવા મળ્યું પછી એને બહુ તરસ લાગી ત્યારે એને થયું કે આટલું લીલુંછમ જંગલ છે. તેથી અહીં પાણી જરૂર હોવું જોઇએ. પાણી વગર કંઇ આ બધું લીલુંછમ થાય નહિ.

"**આપો વૈ પ્રાણઃ**" એવી પાણીની વ્યાખ્યા છે ચોકકસ અહીં પાણી હોવું જોઇએ. એ ખ્યાલથી બિચારો બધે ફરવા લાગ્યો. આ ઝાડ પાસે જાય તે ઝાડ પાસે પણ કોઇ ઠેકાણે પાણી નહીં તેને ખૂબ નવાઇ લાગી આ લીલુંછમ દેખાય છે છતાં પાણી કયાંય કેમ દેખાતું નથી ? તેટલામાં તેને એક ભાઇ મળ્યા પહેલાં ભાઇએ તેમને કહ્યું ગળું બહુ સુકાય છે. અને પાણી મળતું નથી કેટલું શોધ્યું ? આના કરતાં આગળ ગયાં હોત તો કોઇ ગામ આવત અને પાણી તો પીવા મળત પણ આતો અહીંથી ત્યાં અને ત્યાંથી અહી હું અટવાયા કરું છું ત્યારે એ ભાઇએ તેને કહ્યું મારી સાથે આવ. એ ભાઇ તપસ્વી હતા. પોતાની ઝૂંપડીમાં તેને લઇ ગયા બેસાડયા અને પાણી પાયું પછી એમણે કહ્યું. તમે જે અનુમાન કર્યું તે બરાબર છે. આ ધરતીમાં પાણી છે. તેથીજ અહીં લીલુંછમ દેખાય છે. ઝાડનાં મૂળીયાં જમીનમાંથી પાણી ખેંચી શકે છે. પાણી ખેંચવાનું તેમનું સાધન મૂળિયાં છે જે આપણી પાસે નથી. તેથી આપણે તે મેળવવા માટે બીજી યોજના કરવી જોઇએ જેવી કે કૂવો ખોદવો, દોરડી રાખવી ડોલ લેવી અને ડોલથી પાણી કાઢવું તો પાણી મળશેજ. પણ રીત જુદી અપનાવવી પડશે. એવી રીતે આ જગત હસતું નાચતું દેખાય છે. એ કંઇ પોતાની શકિતથી હસે છે. નાચે છે. એની પાછળ કોઇ વૈશ્વિક શકિત જેવી હોય તો કંઇક યોજના કરવી પડે વૃક્ષો મુળીયાંમાંથી પાણી ખેંચી શકે છે. પણ માણસ કંઇ પગના અંગૂઠાથી પાણી ખેંચી શકતો નથી. એટલે તેને ખેંચવાને માટે કંઇક વ્યવસ્થિત યોજના કરવી જોઇએ. અને એવી યોજના કરીને તેમાંથી પાણી લેવું જોઇએ, આ વ્યવસ્થિત યોજના એટલે મુર્તિપૂજા સર્વત્ર લીલુછમ દેખાય છે તેથી પાણી છે. તેવીજ રીતે સર્વત્ર જગત આટલું વ્યવસ્થિત છે એટલે વ્યવસ્થાપક કોઇ એક ઠેકાણે નહીં પણ પ્રત્યેક વસ્તુમાં રહેલા છે તેમાં શંકા નથી તો પછી એ વ્યવસ્થાપક જડતો કેમ નથી ? તે માટે આપણે કંઈક યોજના કરવી પડશે. અને એ યોજના એટલે જ મુર્તિપુજા.

realpatidar.com

https://archive.org/details/bk744/page/n10/mode/1up

realpatidar.com

* જય યોગેશ્વર *

લક્ષ્મીનારાયણ શિબિર
તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ થાણા

તા. ૧૮-૧૨-૭૮
થી
તા. ૨૩-૧૨-૭૮

પૂ. દાદાનાં પ્રવચનોમાંથી ....

- દૈવી જીવન: ભગવાનના કામ માટે જેને જીવન મળ્યું હોય, પ્રભુનું કામ કરીને કાયા દૈવી બનાવી હોય તેનું જીવન જ દૈવી જીવન બની શકે.
- પ્રભુનું કામ કરવું જ હોય તો જીવનમાં સત્યનિષ્ઠા, જીવનનિષ્ઠા, સંતનિષ્ઠા અને બ્રહ્મનિષ્ઠા હોવાં જોઇએ.
- બાળક રડતું હોયને માગતુ હોય પણ રડવાનું ને માગવાનું ગયું તેની બાલિશતા ગઇ કહેવાય.
- અંતિમ સમયે ભગવાન પાસે પણ માગવાનું ન રહે તેવું જીવન જીવાય તો ભગવાન પાસે માગવું પડે ?
- જેનો ધણી મરી જાય તે રડે ? ભગવાન જેવો ધણી જીવતો હોય તો શા માટે રડે ? જીવનમાંથી રડવાનું અને માગવાનું કાઢવા માટે ગીતાનું રહસ્ય જીવનમાં ઉતારવું જોઇએ.
- ઘડપણ એટલે નિરાશા અને ચિંતાથી ભરેલુ જીવન.
- જેના જીવનમાંથી ચિંતા, નિરાશા, માગવાનું અને રડવાનુ ગયું તે યુવાન.
- આ સૃષ્ટિ કોણે નિર્માણ કરી ? આ સૃષ્ટિનું રહસ્ય શું ? તે શોધવાનું અને જીવનનું રહસ્ય શોધવાનું કામ કરે તે યુવાન.
- થાકમાંથી ઇશ્વર ભક્તિ આવે તે પાંગળી હોય. જીવનની ધારણાથી ભક્તિ આવવી જોઈએ.

realpatidar.com

https://archive.org/details/bk744/page/n11/mode/1up

realpatidar.com

- માણસે મરેલાંમાં જીવન જોવાની વૃત્તિવાળા એટલે મત્યુંજય વૃત્તિવાળા બનવું જોઈએ.

- જીવન એ રંગભૂમિ છે, જીવન એ મહાસાગર છે, જીવન એ યુધ્ધ છે, જીવન અનૃત્ય છે, જીવન એક સ્વપ્ન છે. જીવન તરફ જોવાની જેવી જેની દૃષ્ટિ તેવું તેનું જીવન.

- સુખમાં છકી ન જવાનું અને દુ:ખમાં નિરાશ ન થવાનું સંભવે છે ગીતા.

- યજ દેવ પૂજા એટલે યજ્ઞ: ભગવાનનું કામ કરવા માટે એકત્ર થઇ આત્મીયતા ઊભી કરીએ તે યજ્ઞ.

- જીવન ધારણ અને જીવન દૃષ્ટિ એ બંને જુદી બાબતો છે.

- મારૂ જીવન પવિત્ર હોય તો સામાવાળાનું જીવન પણ પવિત્ર બનવુ જોઇએ. મારામાં ભગવાન છે તો સામાવાળામાં પણ ભગવાન છે. મારા પર મને પ્રેમ હોય તો સામાવાળો કે જેનામાં પણ ભગવાન છે તો તેના પર કેમ નહિ ? એવી જીવન નિષ્ઠા હોવી જરૂરી છે.

- ભગવાનની કૃતિ ભાકેત કરનાર માણસ પાસે કાર્યનિષ્ઠા ઉભી થવી જોઇએ. વૈફિલ્યમાંથી જ ભકિત આવે.
  ઊંઘ આવે, ભુખ લાગે, તરસ લાગે પણ ભકિત લાગતી નથી. કારણ કે ભગવાને તે લગાડી નહિ તેથી તેની તે ભુલ છે.

- સંસારની આસકિત રાખીને ભકિત લગાડી છે. એટલે જેટલી આશકિત વધારે તેટલી ભકિત કરવાની અશકિત વધતી જાય.

- બાળક પોતાની માતાને અનેક બહેનોની વચમાંથી પણ શોધી કાઢે છે. માનો છેડો-વિવેક નિષ્ઠ બનીને પકડવાનો

- જીવનમાં સત્યનિષ્ઠા હોવી જોઇએ ભગવાન છે નો વિચાર સત્ય હોય તો ભગવાન મદદ કરશે જ એવો વિશ્વાસ હોવો જોઇએ

- ભગવાનના ભરોંસે જો આપણુ શરીર ચાલતું હોય તો તેના પર ભરોંસો રાખીને કામ કરીએ તો તે કેમ ન થાય ?

realpatidar.com

https://archive.org/details/bk744/page/n12/mode/1up

realpatidar.com

- સત્ય સિધ્ધાંત પર વિશ્વાસ રાખો પ્રભુનું કામ કરવાવાળો માણસ પ્રમાણિક રહે તેથી વિશ્વાસ વધે

- આપણે જયશ્રીકૃષ્ણ કહીએ છીએ. કારણ કે આપણી અને ભગવાનની વચ્ચે હંમેશાં લડાઇ ચાલતી રહી છે. તેમાં ભગવાનનો જ જય છે.

- આપણે કહીએ છીએ કે આ શરીર મારૂ છે પણ ખરેખર તે મારૂ નથી ભકતો કહે છે. કે આ શરીર તારુ છે અને તારા માટે છે. આવી ભાવનાવાળો માણસ અન્યના હકક પર તરાપ નહીં મારે.

- શરીરનો યત્કિંચિત ઉપયોગ પણ ભગવાનના કામમાં થવો જોઇએ માત્ર પોતાના જ કામમાં શરીરનો ઉપયોગ કરનાર ચોર છે.

- પુરૂષ જાતનો કાન સ્ત્રી જાતિના હાથમાં છે. પત્ની તરીકે અને બહેન તરીકે.

- ગોકુળની બહેનો બદલાતાં સારાય ગોકુળની શીકલ બદલાઇ ગઇ ચાલતી રહેલી ખોટી રૂઢિઓ તોડીને કંસની આંખો ખોલનાર બહેનો જ હતી. ધણીને સત્કાર્યમાં પ્રેરીત કરો તો તમેને થોડો ભાગ મળે ભગવાન કાર્યમાં પતિને મદદ કરે તે પત્ની અને મદદ ન કરે તે બાયડી

- કીર્તિ મેળવવા માટે જ કરેલા કામની કોઇ કિંમત નથી.

  વર્ષમાં એક માસ ભગવાનનું કામ કરો તને શિક્ષણ કોને આપ્યું ? મહેનત કરતાંની સાથે સાચો બન.

- અકકલ હોય તો પૈસા મળે તે વાત ખોટી જે કંઇ મળે છે તે પ્રભુની કૃપાથી જ મળે છે. તેમ માનવું જોઈએ. કીર્તિ જો વેચાતી મળે તો પૂણ્ય ન મળે કીર્તિ પણ પ્રભુના ભરોંસે કામ કરીને જ મેળવો.

- ઇશ્વરનું અસ્તિત્વ સિધ્ધ કરવાનું પ્રથમ પગથિયું લો ભગવાનને છોડીને કોઇ પણ કામ ન કરો.

- સોક્રેટીસે ઇંગ્લેન્ડમાં વિવેકનિષ્ઠા ઉભી કરી હતી. વિવેકનિષ્ઠાથી ભગવાનનું કામ થાય

- સત્ય સિધ્ધાંત ઉપર વિશ્વાસ રાખીને સત્યનિષ્ઠાથી માણસ કામ કરશે તો શકિત ભગવાન આપશે સ્વાધ્યાયના કાર્યમાં હું પૈસાવાળો છું એવું અભિમાન છોડી દો.-હું તારો છું નું જ અભિમાન રાખો.

realpatidar.com

https://archive.org/details/bk744/page/n13/mode/1up

realpatidar.com

- સત્યસિધ્ધાંત પર નિષ્ઠા અને કાયમાં પ્રમાણિકતા હોવાં જોઇએ બની ગયેલી ઘટના તે સત્ય નહીં હશે પણ સત્ય તરફ લઇ જનારી ઘટના તે જ સત્ય કહેવાય

- પ્રભુ તરફ ભાવ વધારવા સામાજિક કામ કરશો તો તેજ સાચું કામ છે.

- ભાવના બદલાવાને કામ કરો. તે સત્ય તરફ લઇ જાય તેવાં કામ કરો.

- ભગવાનના કામમાં એ પૈસા વાપરો એમ કહીએ પણ બાકીના પૈસા આપણી પાસે રહે તે કંઇ કોઇને કહેવા જેવી વાત નથી.

- ભણતર રોટલો આપે પણ રોટલા માટે ભણતર મેળવવું તે યોગ્ય નથી.

- ઘસાઇ ગયેલો એટલે ઘરડો —તમે પણ પ્રભુ કાર્યમાં ઘસાઇ જાઓ.

- આજે પ્રત્યેક સત્ય વિચારોમાં અસત્ય ઘૂસી ગયું છે.

- સંત તેને જ કહેવાય કે જે મારા જીવનમાં વસંત ખીલવે. ભગવાનમાં ધ્યાન અને પ્રેમથી થપરિપુર્ણ સંત હોય તે ઋષિ.

- ભગવાનનું કામ કરવું હોય તો જીવનમાં પ્રસન્નતા, નમ્રતા, નિર્ભયતા અને વત્સલતા હોવાં જોઇએ.

- આપણને નરદેહ આપીને ભગવાને સર્વસ્વ આપ્યું છે પણ તેનો સદુપયોગ કરતાં આવડવું જોઇએ કારણ કે બીજી અનેક કૃમિ કીટકોની યોનીઓ કરતાં ઉત્કૃષ્ઠ કોટીનો માનવ દેહ આપણને મળ્યો તે.

- તમારી ગીતામાં મને રસ નથી એવું સીગારેટ ફુંકતો બેસી રહેલો માણસ કહેતો હોય તો તેને ગીતામાંથી રસ ઉડી જવાનું કારણ પુછવું જોઇએ.

- ગરીબોની ગરીબીથી કંટાળતો નથી અને ધનિકોના ધનથી અંજાતો નથી એવી નમ્રતા માણસમાં હોવી જોઇએ. ધર્મનું વાસણ ચોખ્ખું હોવું જોઇએ.

- લઘુતા ગ્રંથી ન હોવી જોઇએ. નમ્યો તે ગમ્યો. નમ્રતામાં સ્વાભિમાન હોય, ઉધ્ધતાઇ જેમાં જરા પણ ન હોય, નિર્ભય અને દૃઢ નિશ્ચયી હોય, કોઇની ખુશામત કે નિંદા ન કરનારો માણસ જ સ્વાધ્યાયી બની શકે.

realpatidar.com

https://archive.org/details/bk744/page/n14/mode/1up

1979-03 -Jagruti (744)

realpatidar.com

- જીવનમાં વાત્સલ્ય દૃષ્ટિ હોવી જોઇએ. ન કહેને પણ બીજા માટે કામ કરવું તેનું નામ વત્સલતા.

- બાળક માટેની જરૂરીયાતોનો ખ્યાલ માતા જેટલા પ્રેમથી કરે છે તેવી વત્સલતા કે પ્રેમ સમાજની વ્યકિતઓમાં એક બીજા પ્રત્યે હોવી જોઇએ.

- પ્રભુનું કામ કરતા રહેલા લોકો પાસે કેટલીક વાતો કરવી જોઇએ માટે જ આપણે એ સમજવું જોઈએ કે નર દેહ એ એક અલૌકિક ઘટના છે, એ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ પ્રત્યેક માનવે ચાલવાનું છે.

  — જગતનો હું માલિક નથી, ગુલામ નથી પણ સેવક છું; મિત્રછું ની નમ્રતા હોવી જોઇએ.

  માતાની બાળક પર જેવી વત્સલતા હોય તેવી વત્સલતા પ્રત્યેકના જીવનમાં હોવી જોઇએ. માતા પણ બાળકની માગ્યા વગર જ ઘણી બધી જરૂરીયાતો પૂરી પાડે છે આપણે પણ એજ રીતે લોકો માગે કે ના માગે પણ ઘેર ઘેર વત્સલતા પુર્વક ગીતા પહોંચાડવાની છે.

- આ માટે જીવનમાં બ્રહ્મચર્ય વૃત્તિ હોવી જોઇએ. પણ આપણે બ્રહ્મચારી વૃત્તિનું અર્થઘટના જુદી રીતે કરીએ છીએ. સ્ત્રી પુરુષનો સંબંધ ન હોય તે બ્રહ્મચારી સ્ત્રી તરફ તિરસ્કારની દૃષ્ટિએ જુએ તે બ્રહ્મચારી પણ એને બ્રહ્મચારી ન કહેવાય. મનથી જ બ્રહ્મચારી વૃત્તિ નિર્માણ થયેલી હોવી જોઇએ.

- બ્રહ્મચર્ય નિષ્ઠા એટલે જીવન તરફ જોવાનો દૃષ્ટિકોણ. બ્રહ્મને શોધવાનું કામ કરવા નો દ્રષ્ટિકોણ રાખે તે બ્રહ્મચારી.

- વિદ્વતા, પૈસો વગેરે ભગવાનનું કામ કરવામાં ન વપરાય તે ઉપભોગની દૃષ્ટિ અને ભગવાનના કામમાં વપરાય તો ભાવ દ્રષ્ટિ આપે છે.

- પ્રત્યેક જીવ માટે "વાસના" કે "વાસુદેવ" એ મોટો પ્રશ્ન છે. વાસનાસભર લોકો પણ વાસુદેવને નમે છે અને "વાસુદેવ" ને માનવાવાળા લોકો પણ વાસના ને પકડી રાખે છે. વાસના ને પ્રધાન રાખીને મંદિરમાં આવવાવાળો ભકત અને વાસુદેવને પ્રધાન રાખીને માર્કેટમાં જવાવાળા ભકતોમાંથી પ્રથમનો ભકત એ બ્રહ્મચારી નથી જયારે બીજો બ્રહ્મચારી છે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 13 of 25

https://archive.org/details/bk744/page/n15/mode/1up

realpatidar.com

- ગાર્ગીએ ઉપનિષદમાં યાજ્ઞ વલ્કયને પણ સભળાવી દીધું છે કે નારાયણ પાસે લક્ષ્મી ઉભી કરી છે. જીવનના દરેક વ્યવહારમાં તમે વાસના રાખ્યા વગર પ્રભુ પરનો ભાવ વધારીને કામ કરતા હશો તો તમે પણ બ્રહ્મચારી છો. બ્રહ્મચારી એટલે સ્ત્રીનો તીરસ્કાર કે નિંદા નથી સંસ્કૃતિએ પણ સ્ત્રી નો તિરસ્કાર કે નિંદા નથી કર્યા
ઉભયલીંગી પ્રજા કરાવીને હું "કોઇનો" છું એવી ભાવના પ્રભાવિત કરવા માટે છે. ધણી એકલીંગી ચૈતન્ય શકિત પણ છે.

- ભગવાનના કામ માટે માર્કેટમાં જનાર માણસ જે માર્કેટમાં જાય છે તે માર્કેટ પણ મંદિર જ છે અને મંદિરમાં પણ વાસનાની દ્રષ્ટિએ જશે તો તે મંદિર પણ માર્કેટ જ છે.

- ભણનાર કઇ દૃષ્ટિએ ભણે છે. વેપારી કઈ દ્રષ્ટિએ વેપાર કરે છે. બીજાના ગજવામાં રહેલો પૈસો પોતાના ગજવામાં શી રીતે આવે તેની કલા તમે નિર્માણ કરો છો ?

- ભગવાનનો ફોટા બધી દુકાનમાં હોય પણ ભગવાનને માટે દુકાન નથી એવા બ્રહ્મચારી આપણે છીએ.

- બ્રહ્મચર્ય એ જીવનનો વ્યાપક દૃષ્ટિકોણ છે. માગીને ઓછું મળશે જયારે ન માગ્યે ધણું મળશે.

- પ્રભુનું કામ એ કેવળ અંદર બેઠેલા ભગવાનનું કામ છે. માણસની કિંમત ઋષિઓએ ઉભી કરી છે. સ્વાધ્યાયથી માણસની ખોપરીમાંથી ગરીબી દૂર થઇ શકે છે. ગરીબી હોય તેથી શું ? ગરીબીમાં પણ અંદર બેઠેલો ભગવાન ખોલે કીડી જો કણ રળી શકે તો માણસ રોટલો પણ ન રળી શકે.

- આ વિશ્વમાં ભકિત એ મોટું બળ છે. અશકત માણસ માટે હું શા માટે જાઉં તેનો જવાબ સામાજિક કે રાજકીય માણસો પાસે નથી. એ સ્વાધ્યાયી પાસે છે. તેને બેઠો કરવાની શકિત સ્વાધ્યાયીમાં છે. સ્ત્રી અને પુરૂષ બંને ભગવાને નિર્માણ કરેલા જીવો છે. બ્રહ્મચારી એ જીવનવૃતિ છે, જીવન માગ છે. કેવળ સ્ત્રી સાથે સબંધ ન રાખે તે બ્રહ્મચારી એ વાત જ ખોટી છે. ભોગદૃષ્ટિથી જુઓ તો બ્રહ્મચર્ય તુટે અને ભાવ દૃષ્ટિથી કોઈ પણ કામ તરફ જુઓ તો બ્રહ્મચર્ય વધે,

realpatidar.com

https://archive.org/details/bk744/page/n16/mode/1up

realpatidar.com

॥ શ્રી જય જગદંબા મા ॥

ધન્ય ચેલૈયો !

પટેલ અંબાલાલ જી.
અજુપુરા, (ડાકોર)

કાન્તિનગર નામે નગર હતું. ત્યાં સગાળશાહ કરીને એક વણિક રહેતો હતો, તેના માતાપિતા સત્યવાદી, દાની, સદાચારી અને અતિથિનો સત્કાર કરનાર હતાં. માતાપિતાના આ સદ્‌ગુણો પુત્ર શગાળશાહમાં ઉતર્યા હતા. શગાળશાહને ચાંગુણા નામે સદાચારિણી પત્ની હતી. તેણે વ્રત લીધું હતું કે અતિથિને ભોજન જમાડીને જ જમવું.

એક સમયે નારદ મૂનિજ ફરતા કૈલાસ પર્વત ઉપર ભગવાન શંકર અને પાર્વતી પાસે આવી પહોંચ્યા. અને ત્યાં શગાળશાહ શેઠ અને તેની પત્ની ચાંગુણાનાં ખૂબ વખાણ કરવા લાગ્યા, એ સાંભળી ભગવાન શંકર તેમની પરિક્ષા કરવા સારૂ બ્રાહ્મણનુ સ્વરૂપ ધારણ કરી કાન્તિનગરમાં આવ્યા. તે દિવસે કોઈ અતિથિ આવ્યો નહીં, તેથી શેઠ શેઠાણી અતિથિની શોધ કરવા લાગ્યાં. એવામાં ભગવાન શંકર કે જેમણે બ્રાહ્મણનું રૂપ લીધું હતું, તે તેમને મળ્યા અને દંપતિએ ભોજન માટે આમંત્રણ આપ્યું. બ્રાહ્મણે કહ્યું. ' મારી ઇચ્છા તારાથી પૂર્ણ થઇ શકશે નહી, મારી પ્રતિજ્ઞા પૂણ કરી શકે તોજ આવું.

શામળશાહે અતિથિને પ્રાર્થના કરી ઇચ્છા જણાવવા કહ્યું. અને પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ એમ જયારે બોલ્યા ત્યારે બ્રાહ્મણે કહ્યું. "મને એવી કોઇ વ્યકિતનું માંસ લાવી આપો કે જે વૃધ્ધ ન હોય, રોગી ન હોય. કોઇ અંગ ખંડિત ન હોય, પૈસા આપીને માંસ ખરીદેલું ન હોય, પ્રજા નો પાલક રાજા ન હોય. કે ન હોય રાણી"

શગાળશાહની ધ્યાનમાં એવી એક પણ વ્યકિત દેખાઇ નહિં. બન્ને જણાં પોત પોતાનું બલિદાન દેવા તૈયાર થયાં, પરંતુ અતિથિએ તેનો સ્વીકાર કર્યો નહીં શગાળશાહે ફરીથી પ્રાર્થના કરી જે ઇચ્છા હોય, તે પ્રગટ કરવા જણાવ્યું. ત્યારે અતિથિએ કહ્યું. "તમે કહેવા મુજબ કોઈ વ્યકિતનું માંસ લઇ આવી શકતા નથી. તો પછી તમારા પુત્ર ચેલૈયાનું માંસ મને આપો" શેઠ શેઠાણીને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે અતિથિ આવી માંગણી કરશે. શેઠ શેઠાણી બન્નેએ હા પાડી અને શેઠાણી અંદર ચેલૈયાને હાથમાં તેડી લાવી ભેટી પડી, ચુંબન કરવા

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk744/page/n17/mode/1up

realpatidar.com

લાગી. બન્યે આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યાં, ધ્રુસકે ધ્રુસકે રડી પડી બાળક ગભરાઇ ગયો તેનાથી સમજાયું નહીં. કે માતા કેમ રડે છે. એક બાજુ માતાનો પુત્ર પ્રેમ, અને બીજી બાજુ પુત્રનું માંસ અતિથિને ભોજનમાં આપવાનું વ્રત લીધેલું ના પડાય તેમ નહતું, વચન ભંગ પણ કેમ થવાય ? પુત્રને અંતિમ ભેટી લઇ ચૂંબન કર્યાં અને રડી રડીને હૈયું ઠાલવ્યું.

અતિથિએ આ દશ્ય જોયું અને બોલ્યા કે બાળક ઉપર તમને ઘણી મમતા છે. તેથી મારી માગણી તમારાથી પૂર્ણ થશે નહિ, માટે મને જવાદો પુત્ર ચેલૈયો અતિથિ સાથેની માતા પિતાની વાત ચીત ઉપરથી સમજી ગયો તે બોલ્યો માતા તારીજ મને શિખામણ હતી. શરીર કોઈ પરોપકાર અર્થે આવતું હોય તો ભલે મૃત્યું મળે તેનાથી તો સ્વર્ગ મળશે, માટે તું મને આ બ્રાહ્મણ ને અપર્ણ કરીદે તે એક વાર મને કહેલું કે મરતી વખતે જે જેનું ધ્યાન કરે છે. તેજ તેને બીજા જન્મમાં મળે છે માટે હું મૃત્યું સમય ધ્યાન ધરૂ છું. કે મારો આવતો જન્મ પણ તારા પુત્ર રૂપે જ થાય માટે તુ શોક કરવો મુકી દે. માતા ચાંગુણાએ હાથમાં તલવાર લઈ પુત્ર ચેલૈયાનું મસ્તક ધડથી જુદુ કરી નાખ્યું અને તે દશ્ય મૂર્છા પામી શગાળશાહે ચાંગુણાની આંખમાં પાણી છાંટયું અતિથિની વાત યાદ કરી. ત્યાં શેઠાણી સચેત ઉઠી પુત્રનું મસ્તક લઇ ચુબન કર્યું મસ્તકને લઇ અતિથિ પાસે આવી અતિથિ ગુસ્સે થઇ બોલ્યા કે મને રાંધ્યા વિનાનું કાચ્ચુ માંસ પીરશે છે. શું તુ મને જનાવર સમજે છે કે હું કાચ્ચું માંસ ખાઇશ ? શેઠાણીએ માંસ રાંધીને અતિથિ પાસે મૂકયું અતિથિ તથીપણ સંતુષ્ટ થયા નહીં અને ગુસ્સાથી બોલ્યા કે જે મસ્તક બહું મુલ્યવાળુ છે. તે તુ છૂપાવી રાખ્યુ છે. શેઠાણી સમજી કે આ કોઇ દેવ મારી પરીક્ષા લેવાજ આવ્યા લાગે છે. શેઠાણી પુત્રનું મસ્તક લઇ આંવી ત્યારે કહયુ કે મારી સામે આ ખાણીયામાં મસ્તકને મુકી કુટ અને હસતે મોઢે ખાણીયામાં ખોડી તૈયાર કર શેઠાણીએ કઠણ હ્રદય કરી પ્રભુ સ્મરણ કરી ખાણિયો લઇ આવી તેમાં તેનું મસ્તક મુકયું. આંખમાંથી આસુ લુછી નાખી હસતે મુખે ગીતો ગાવા લાગી અને મસ્તક ખાંડવા લાગી, પછી માંસને રાંધી થાળીમાં પીરશી અતિથિની સામે જ ચાગુણાએ ધર્યું ચાંગુણા મનમાં વિચાર કરે છે કે અતિથિને ભોજન કરાવી એ વિદાય થાય કે એટલે હું ચેલૈયાની પાછળ હુ પણ સ્વર્ગ સીધાઉં

એટલામાં અતિથિ બોલ્યા કે શેઠાણી તમે બન્ને મારી સાથે બેસી ભોજન કરો તો જ હું જમીશ શેઠશેઠાણી હવે તો ખુબજ મુજવણમાં પડી ગયાં શેઠાણી બોલી ઉઠી ભગવન મારા પેટથી જન્મેલો પુત્ર ફરી પાછો મારા પેટમાં જાય તો

realpatidar.com

https://archive.org/details/bk744/page/n18/mode/1up

1979-03 -Jagruti (744)

realpatidar.com

કેટલું દુઃખ થશે. એમ ખૂબ દુઃખી હૃદયે બોલી છતાં મન કઠણ કરી અતિથિની વાત માની અને ચાંગુણા અતિથિ પાસે આવી બેઠાં પણ હજુ પરિક્ષા સમાપ્ત થઇ નથી અતિથિ બોલ્યા કે ચાંગુણા તું તો હવે નિઃસંતાન છે તો તારા હાથનું ભોજન હું શી રીતે સ્વીકારૂ ? હું તો ચાલ્યો જાઉં છું આ સાંભળી ચાંગુણા કહેવા લાગી આપની આજ્ઞાથી મારા એકના એક પુત્રને મારી નાખ્યો હવે બીજો પુત્ર કયાંથી લાવું ? આપતો તે વખતે પણ જાણતા હતાજ કે મારે એક જ પુત્ર છે. તો આપે એવી માગણી કેમ કરી । હું આપણી પુત્રી છું મારા ઉપર દયા કરો અને ખૂબ પ્રાર્થના કરવા લાગી.

જયારે ચાંગુણાએ અતિથિનો પગ પકડેલો છોડયો નહીં, ત્યારે અતિથિ બોલ્યા "પુત્રી ! તારા પુત્રને બોલાવ." ચાંગુણાએ ચેલૈયાને બુમ પાડી બોલાવ્યો એટલામાં તો ચેલૈયો સામેથી જ દોડતો આવતો દીઠો. અતિથિ અંતર્ધાન થઇ ગયા અને ભગવાન શંકર સ્વરૂપે પ્રત્યક્ષ થઇ શેઠાણીને અને શેઠને દર્શન દીધાં. ચેલૈયાને હાથમાં લઇ ચાંગુણાને સોંપ્યો અને બોલ્યો, " પુત્રી ? એ અતિથિ હું પોતે જ હતો, તારી પરીક્ષા કરવા આવ્યો હતો. તારાથી પ્રસન્ન થયો છું. તુ વરદાન માગ" ચાંગુણા બોલી " મારા વ્રત પ્રમાણે અતિથિની સેવા કરૂં એમાંજ મારી સદ્‌બુદ્ધિ બની રહે" ભગવાન 'તથાસ્તુ" કહી અંતર્ધાન થઇ ગયા.

નારદ સ્વર્ગમાં પણ બીજા દેવોને આ વાત કહી આવેલાં. તેથી આ દૃશ્ય જોવા ઘણા દેવો અને પાર્વતી પણ છુપી રીતે આવેલાં અને આ દૃશ્ય નજરે જોયું. આ પરીક્ષા જોઇ ચાંગુણાની અતિશય પ્રસંસા કરવા લાગ્યા.

" ધન્ય છે ચાંગુણાની ટેકને "

realpatidar.com

Link: http://www.realpatidar.com/library Page 17 of 25
email: mail@realpatidar.com

https://archive.org/details/bk744/page/n19/mode/1up

realpatidar.com

॥ શ્રી ઉમિયા માતાકી જય ॥

સાબરકાંઠા વિભાગમાં વસતા શ્રી કચ્છી ક. પાટીદાર જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે ચાલતા સંઘર્ષ અંગે

* લવાદ પંચનો ચુકાદો *

ગુજરાતમાં વસતા કચ્છી કડવા પાટીદાર ભાઈઓ વચ્ચે, ધનસુરા મધ્યે શ્રી ક. ક. પાટીદાર સનાતન સમાજના નામે ચાલતી સંસ્થાના સભ્યપદના પ્રશ્ને એક જોરદાર વિવાદ ઊભો થયો જેના પરિણામે અલગ અલગ માન્યતાઓ વાળાં બે જૂથો અમુક વ્યક્તિઓની આડમાં એકબીજા સામે સંઘર્ષમાં ઉતરી કોર્ટે ચડયાં એકે આરોપ્યું કે જે સનાતની નથી તેને સંસ્થાના સભ્ય થવાનો કોઈ હકક નથી જયારે બીજાએ કહયું કે અમે સનાતની છીએ અને સભ્ય ફી ભરી છે. તેથી અમે સભ્ય છીએ અને અમને ગેર-બંધારણીય રીતે સભ્ય તરીકે રદ ગણવામાં આવ્યા છે. આ મુદ્દાને લઈને મોડાસા કોર્ટમાં તેમજ અરસપરસ દબાણ ખાતર બીજી કોર્ટોમાં પણ વ્યક્તિઓના આશ્રયે પક્ષકાર ખટલાઓ શરૂ કરવામાં આવ્યા.

આ ઘર્ષણના આવા સમાચાર આડકતરી રીતે તેમજ પક્ષકારો દ્વારા જાણવા મળતાં ગુજરાત બહાર વસતા ક. ક પાટીદર જ્ઞાતિજનોને દુઃખ થયું અને સમાધાન માટેના પ્રયાસો થવા લાગ્યા. સ્થાનિક ક્ષેત્રે પણ ઇતર કોમોમાં આ વિવાદ અંગે કુતુહલ જાગ્યુ અને પ્રતિષ્ઠિત કચ્છી પટીદારો પ્રત્યે વિસ્મયકારક પ્રશ્નો રજૂ થવા લાગ્યા. "માનહાની એ બહુમાનીને મૃત્યુ કરતાં પણ વિશેષ દુઃખકર હોય છે." તે ન્યાયે પક્ષકારોમાં પણ સમાધાન માટેની વૃત્તિ જાગવા માંડી કોર્ટ બહાર નિરાકરણ માટે લવાદપંચની આવશ્યકતા જણાઇ અને બંને પક્ષકારોએ શ્રી ક. ક. પાટીદાર સમાજ-મુંબઇનો સંપર્ક સાધ્યો અલગ અલગ જઈને અને પરિણામે તા. ૧૫-૧-૭૯ ના રોજ મુંબઇથી (૧) શ્રી મણીલાલભાઇ પુંજાભાઇ (૨) શ્રી માવજીભાઇ પેથાભાઇ પોકાર (૩) શ્રી વિશ્રામભાઇ હંસરાજભાઇ (૪) શ્રી પ્રેમજીભાઇ શિવગણભાઇ (૫) શ્રી શિવદાસભાઇ લાલજીભાઇ તથા (૬) શ્રી લખમશીભાઇ લધાભાઈ તેમજ અમદાવાદ થી શ્રી જેઠાભાઇ પુંજાભાઇ તથા વડોદરાથી શ્રી રતનશીભાઇ નારાયણભાઇ તથા

માર્ચ-૭૯

realpatidar.com

https://archive.org/details/bk744/page/n20/mode/1up

1979-03 -Jagruti (744)

જબલપુરથી શ્રી રામજીભાઇ શામજીભાઇ એમ. નવ જ્ઞાતિ ભાઇઓનું એક મંડળ સમાધાનના આશયથી આવ્યું અને બંને પક્ષોનો સંપર્ક સાધવાથી તા. ૧૨-૧-૧૯૭૯ ના રોજ બંને એ તે મંડળની મૌખિક લવાદપંચ તરીકેની નીમણુંક કરી અને પોતપોતાના પક્ષોમાંથી જવાબદાર અગ્રગણ્ય ભાઇઓની એક એક સમિતિ પંચના સતત સંપર્કમાં રહેવા નક્કી કરી તદુપરાંત બંને પક્ષોએ પોતપોતાની માગણીઓની વિશદ ચર્ચા કર્યા બાદ, લેખિત રજૂઆત કરી ત્યારબાદ લવાદપંચની સૂચનાનુસાર બંને પક્ષોએ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ આપી લવાદોનો રીતસરનો અધિકાર આપ્યો અને સોમવાર તા. ૧૫-૧-૭૯ ના રોજ કોર્ટમાં ચાલુ રહેલા અરસપરસના બધાજ ખટલા તથા ચેરીટી કમિશ્નર સમક્ષની અરજી વગેરે પાછા ખેંચી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને લવાદપંચે કામગીરી ચાલુ કરી.

પંચની સમક્ષ નીચે જણાવેલ મુદ્દાઓ તપાસ અને નિર્ણય માટે રજૂ થયા હતા.

(૧) શ્રી નાનજીભાઇ કાનજીભાઇ સાથેનો હીસાબ અને લેણાની વસુલી અને ખટલાઓ પાછા ખેંચવા બાબત.

(૨) સમાજનું સભ્યપદ, માન્યતા અને અમાન્યતા તથા બંધારણમાં ફેરફાર કરવા બાબત.

(૩) કારોબારી અને પ્રતિનિધિત્વ.

(૪) ભવિષ્ય માટેનો વ્યવહાર સરળ થવા બાબત.

ઉપર્યુકત મુદ્દાઓની તપાસ લવાદપચે શરૂ કરી અને જે નિર્ણયો કરવામાં આવ્યા તે નીચે મુજબ છે.

સમાજ અને શ્રી નાનજીભાઇ કાનજીભાઇ તથા બીજા ભાઇઓ વચ્ચે કોર્ટોમાં ચાલતા તમામ કેસો લવાદપંચની સૂચના અનુસાર બંને પક્ષો તરફથી પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને ચેરીટી કમિશ્નર સમક્ષ કરવામાં આવેલી અરજી પણ પાછી ખેંચી લેવામાં આવી છે એટલે બધાજ ખટલાઓનો અંત લાવવામાં આવ્યો અને બંને પક્ષો તરફથી સમાજના વિવાદોનો નિર્ણય સમાજનાજ ભાઇઓ દ્વારા લાવવાની નીતિ અપનાવી છે તે પ્રશંસનીય છે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 19 of 25

https://archive.org/details/bk744/page/n21/mode/1up

realpatidar.com

સમાજ તથા શ્રી નાનજીભાઇ કાનજીભાઇ વચ્ચે હીસાબ અંગેના વિવાદને હાથ ધરતાં બેન પાર્વતીબેનના ભરણપોષણ નિમિત્તેના અમાનત રખાયેલા રૂા. ૧૦,૦૦૦/- તથા લવાદપંચે નકકી કરેલ વ્યાજના રૂા. ૨,૦૦૦/- મળીને કુલ રૂા. ૧૨,૦૦૦/- અક્ષરે રૂપિયા બાર હજાર પુરા રોકડા બેન પાર્વતીબેનને તેના ભાઇશ્રી કાન્તિલાલ કરસનભાઇની હાજરીમાં નાનજીભાઇ કાનજીભાઇ તરફથી ચૂકવી આપવામાં આવ્યા છે. જેની પહોંચ પણ મેળવવામાં આવી છે.

સમાજની લેતીદેતી બારામાં હીસાબ કરતાં શ્રી નાનજીભાઇ કાનજીભાઇ ખાતે નીકળતા રૂા. ૧૫.૮૦૦/- પંચની સમક્ષ સમાજને ચૂકવી આપવામાં આવ્યા છે જેમની પહોંચ પણ લેવામાં આવી છે. અને રૂા. ૧૨,૫૫૪/- નો હીસાબ શ્રી નાનજીભાઇ કાનજીભાઇ તરફથી સમાજના મંત્રીશ્રી બેચરભાઇ મુળજીભાઇને તા. ૮-૬-૧૯૭૮ના રોજે સમજાવી અને ચુકવી આપ્યો હતો અને તે બાબતની ચોખવટ પણ કરવામાં આવી હતી એટલે સમાજના કોઇ હીસાબની લેતીદેતી શ્રી નાનજીભાઈ કાનજીભાઇ હસ્તે હવે આજ સુધીની બાકી રહેતી નથી.

જાગૃતિ કાર્યાલયના કુલ્લે રૂા. ૩૪૦૦૦/- સમાજના કાર્યકર ભાઇઓ જણ સાત પાસે વ્યાજે મુકવામાં આવેલ છે તે પૈકીના રૂા. ૫૫૦૦/- શ્રી નાનજીભાઈ કાનજીભાઇ પાસે પણ રહે છે. તો તે રકમ જ્યારે કાર્યાલય બધા ભાઇઓ પાસે માગણી કરે ત્યારે શ્રી નાનજીભાઇ કાનજીભાઇએ પણ ચૂકવવાના રહેશે. આથી આ સિવાય સમાજનો જાગૃતિ કાર્યાલય અંગેનો પણ કોઇ હિસાબ શ્રી નાનજીભાઈ કાનજીભાઇ હસ્તક રહેતો નથી.

આમ સમાજ તથા શ્રી નાનજીભાઇ વચ્ચે હીસાબ પંચ સમક્ષ પૂર્ણ થયો છે અને પંચને આ બારામાં સુખદ અંત લાવવામાં સહકાર બંને પક્ષોએ સારો આપ્યો છે.

શ્રી વાલજીભાઇ· કાનજીભાઈ તથા શ્રી નાનજીભાઈએ સમાજને લાંબા સમય સુધી ખૂબ સેવા આપી છે પરંતુ હાલના સંજોગોના સંદર્ભમાં શ્રી નાનજીભાઇએ સમાજને સક્રિય સેવા આપવાની લેખિત નાખુશી જણાવી છે આશા છે કે સમાજ તેની શકિતનો લાભ લેશે.

આ તબકકે એ બાબતની નોંધ લેવી પડે છે કે સમાજના અગ્રણી જેવા શ્રી નાનજીભાઇ સમાજના હિતને હાનિકર્તા પ્રવૃત્તિમાં સહભાગી થયા જે યોગ્ય થયું

realpatidar.com

Link: http://www.realpatidar.com/library Page 20 of 25
email: mail@realpatidar.com

https://archive.org/details/bk744/page/n22/mode/1up

realpatidar.com

નથી. પરંતુ હવે તે વિવાદનો સુખદ અંત આવ્યો છે અને આશા છે કે તેઓ સમાજ હિતાર્થે પોતાની શક્તિનો સદુપયોગ કરતા રહેશે.

સમાજ તરફથી તા. ૯-૬-૧૯૭૮ના રોજ મળેલી કારોબારી સભાએ જે સભ્યોને અમાન્ય કર્યા છે. તે બાબતમાં પંચે બંને પક્ષો સાથે લંબાણથી ચર્ચા કરી છે અને પંચ નીચે મુજબના નિર્ણય ઉપર સર્વાનુમતે આવ્યો છે.

સમાજના નામ અંગે "શ્રી ક. ક. પા. સનાતન સમાજ, ધનસુરા" આ નામથી સંસ્થા ચાલે છે અને તે બંધારણીય સંસ્થા છે અને જેનુ બંધારણ સન ૧૯૭૨માં રજીસ્ટર કરવામાં આવ્યું છે અને સમાજના નામમાં ફેરફાર કરવાનો કોઇ પ્રશ્ન જ નથી.

સભ્યપદનો પ્રશ્ન ખાસ અગત્યનો હોવાથી બંને પક્ષકારોની પ્રતિનિધિ સમિતિઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને ચર્ચામાં હકીકતો રજૂ થઇ કે સભ્યપદ માટેની ફી લઇને સભ્ય બનાવ્યા બાદ બંધારણીય રીતે રદ કરી શકાય નહિ અને અમાન્ય કરાયેલા બધા જ સભ્યો સનાતની નથી એમ કહી શકાય નહીં એટલે સમગ્ર રીતે એક જ સિધ્ધાંત પળાયો નથી. અને જે સભ્યો બનાવાયા છે તે સનાતન સમાજના બંધારણ અનુસાર બનાવવામાં આવ્યા છે. અને અ. ભા. ક. ક. પાટીદાર સમાજના રીતરીવાજો અને ધારાધોરણને માન્ય રાખીને સભ્ય બન્યા છે તો કયા સભ્યો સનાતની નથી તેનો વિવાદ ઊભો ન કરતાં હાલના તબક્કે જે સભ્યો બનાવવામાં આવ્યા છે તેમને માન્યતા આપવી અને તેવા સભ્યોએ સમાજના બંધારણ અને અ. ભા. ક. ક. પાટીદાર સમાજના રીતરિવાજો અને ધારાધોરણ પ્રમાણે વર્તવાનું રહેશે અને તે મુજબ વર્તન કરવાની રજૂઆત કરવામાં આવી છે તો સમાજે જે ભાઇઓ સનાતન સમાજના સભ્ય બનતા હોય અને જ્ઞાતિના રીતરિવાજો અને ધારાધોરણ અનુસાર વર્તવા માગતા હોય તો તેને આવકારવા જોઇએ એટલે હાલના તબક્કે નોંધાયેલા સભ્યોને માન્ય કરવામાં આવે છે અને સર્વ ભાઇઓ સમાજમાં કેળવણી અને સામાજિક એકતા અંગે સાથ સહકાર અને ભાવનાથી કાર્ય કરશે તેવી આશા છે.

સમાજના બંધારણ અનુસાર તા. ૨-૧-૧૯૭૨ના રોજે સમાજની જનરલ સભાએ કારોબારી સમિતિની ચૂંટણી કરી છે અને તે કારોબારીએ સન ૧૯૭૭ સુધી વહીવટ ચલાવ્યો છે. અને ત્યારબાદ ૩-૯-૭૭ ની સામાન્ય સભાએ નવી કારોબારીની ચૂંટણી કરી છે દરમ્યાનમાં એક પણ જનરલ સભા મળી નથી. અને

realpatidar.com

https://archive.org/details/bk744/page/n23/mode/1up

realpatidar.com

ઘણુંજ લાંબા સમય બાદ કારોબારી સમિતિની ચૂંટણી કરવામાં આવી છે તો સમાજના કાર્યકર ભાઈઓએ સમાજના બંધારણ અનુસાર કાર્ય કરવામાં ચુસ્ત રહેવું જોઈએ અને બંધારણ અનુસાર કાર્ય કરવું જોઈએ એ કાર્યકર્તાઓની ફરજ છે. તા. ૩–૯–૭૭ના રોજ ચૂંટાયેલ કારોબારી સમિતિની મુદત બંધારણ અનુસાર પૂરી થઈ નથી તો મુદત પૂરી થયે જનરલ સભા બોલાવવી અને કા. સમિતિની ચૂંટણી કરવી. અને તે દરમ્યાન હાલની ચૂંટાયેલી કારોબારી સમિતિએ કાર્ય કરવું ચાલુ ચૂંટાયેલી કારોબારી સમિતિને જો યોગ્ય જણાય અને કારોબારીમાં ફેરફાર કરવા ઇચ્છે તો સક્રિય કાર્યકરોને લઈને કરી શકશે, સમાજના કાર્યકર ભાઈઓએ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે કે એક બીજા પ્રત્યે ભાવના ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ અને અનુકુળ વાતાવરણ સર્જવું જોઈએ.

ઉપરની બધી જ હકીકતોની નજરે લવાદપંચ એવો નિર્ણય કરે છે કે શ્રી ક. ક. પાટીદાર સનાતન સમાજ ધનસુરા વતી જે સભ્યોને અમાન્ય રખાયા છે તેમને આથી માન્યતા આપવામાં આવે છે અને સભ્યો અખિલ ક. ક. પાટીદાર સમાજે ઘડેલા અને છાપીને પ્રગટ કરેલા રીતરિવાજો અને ધારાધોરણનું ચુસ્ત પાલન કરશે અને તો જ આ સમાજના સભ્ય તરીકે ચાલુ રહી શકશે.

કારોબારીની ચૂંટણી બંધારણના નિયમ અનુસાર થવી જોઈએ. બંધારણની કલમોમાં પણ ફેરફાર તેની રૂએ જ કરી શકાશે.

ઉપર મુજબનો નિર્ણય અમો લવાદપંચના સભ્યોએ ઈશ્વરની સાક્ષીએ નિષ્પક્ષપણે અને જ્ઞાતિના હિતને ધ્યાનમાં રાખીને કરેલ છે.

ધનસુરા
તા. ૧૯મી જાન્યુઆરી ૧૯૭૯
વાર શુક્રવાર

લવાદપંચ

(૧) મણીલાલ પુંજાભાઇ પટેલ
(૨) માવજીભાઇ પેથાભાઇ પોકાર
(૩) વિશ્રામ હંસરાજ પટેલ
(૪) પ્રેમજી સવગણ પટેલ
(૫) સવદાસ લાલજી માવાણી
(૬) લખમશી લધ્ધા પટેલ
(૭) જેઠાભાઇ પુંજાભાઇ પટેલ
(૮) રતનશી નારણભાઈ પટેલ
(૯) રામજીભાઇ શામજીભાઈ પટેલ
(જબલપુર)

realpatidar.com

email: mail@realpatidar.com

https://archive.org/details/bk744/page/n24/mode/1up

realpatidar.com



વિકાસ...
ઉત્પાદન....
નફો.....

સૂક્ષ્મીણ-ઝેંક
(ચીલેટેડ ઝીંક સ્પ્રે)

- ★ પાકની ગુણવત્તા વધારે છે.
- ★ વધુ ઉત્પાદન મળે છે.
- ★ ખર્ચના પ્રમાણમાં વધુ આવક.
- ★ છોડના બધા ભાગોમાં જલદી પ્રસરી જઈ જસતની ઉણપ દૂર કરે છે.
- ★ સૂકી અને પિયત એમ બન્ને ખેતી માટે ઉપયોગી.
- ★ પાક ઉપર છાંટવાનું હોવાથી જસત તત્વનું સ્થિરિકરણ થતું નથી.

Poushak

પૌષક લિમિટેડ
એલેમ્બિક રોડ. વડોદરા–૩૯૦ ૦૦૩

સ્ટોકીસ્ટ :—

- ★ મે. ઘનશ્યામ ફર્ટીલાઈઝર, ગાબટ રોડ, બાયડ.
- ★ મે. કિશાન ટ્રેડર્સ., એસ. ટી. ડેપો પાસે, મોડાસા.
- ★ મે. પટેલ ફર્ટીલાઈઝર ટ્રે. કું. સ્ટેશન રોડ, હિંમતનગર.
- ★ મે. અમર ફર્ટીલાઈઝર, સહકારી સંઘ સામે, ઈડર.

realpatidar.com

realpatidar.com

JAGRUTI MARCH–'79 Reg. No. GHMR/3

રવાના :
જાગૃતિ કાર્યાલય
પટેલવાડી, તલોદરોડ,
ધનસુરા. જિ.સાબરકાંઠા
પીન. ૩૮૩૩૧૦

ગ્રા. નં.

પ્રકાશક :
શ્રી. વિશ્રામભાઈ એન. પટેલ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
યુવક મંડળ (ગુજરાત)
"જાગૃતિ કાર્યાલય"
પટેલવાડી, તલોદ રોડ,
ધનસુરા, જિ. સાબરકાંઠા.

To,

25 K. D. Patel & Co.
87, Diamond Harbour Road
(Behala) Calcutta-~~38~~ 700034

Boook – Post

શ્રી કાન્તિભાઈ કે. પટેલ
અનુપમ પ્રિન્ટિંગ પ્રેસ
હાઈસ્કૂલ સામે, તલોદ રોડ,
ધનસુરા, જિ. સાબરકાંઠા.

realpatidar.com

https://archive.org/details/bk744/page/n26/mode/1up

realpatidar.com

JAGRUTI MARCH-'79 Reg. No. GHMR/3

પ્રકાશક :
શ્રી. વિશ્રામભાઈ એન. પટેલ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
યુવક મંડળ (ગુજરાત)
"જાગૃતિ કાર્યાલય"
પટેલવાડી, તલોદ રોડ,
ધનસુરા, જિ. સાબરકાંઠા.

ગ્રા. નં.

સ્થળ :
જાગૃતિ કાર્યાલય
પટેલવાડી, તલોદ રોડ,
ધનસુરા. જિ. સાબરકાંઠા
પીન. 383310

Boook - Post

To,

25 K. D. Patel & Co.
87, Diamond Harbour Road
(Behala) Calcutta-~~38~~ 700034

શ્રી કાન્તિભાઈ કે. પટેલ
અનુપમ પ્રિન્ટિંગ પ્રેસ
હાઈસ્કૂલ સામે, તલોદ રોડ,
ધનસુરા, જિ. સાબરકાંઠા.

realpatidar.com